

# IIT-Gના ૩ પ્રોફેસરની

## રામાનુજન ફેલોશિપ

### માટે પસંદગી

નવગુજરાત સમય > અમદાવાદ

લોકોપયોગી સંશોધન હેતુથી અપાતી રામાનુજન ફેલોશિપ ૨૦૧૫ માટે કેન્દ્ર સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયે આઈઆઈટી ગાંધીનગરના ત્રણ પ્રોફેસરની પસંદગી કરી છે. આ પ્રોફેસરમાં અર્ણબ દત્તા અને સૌમ્યકાંતિ ખટુઆ કેમિસ્ટ્રી વિષયના છે, જ્યારે વિરુપાક્ષી સોષ્ણિના બાયોલોજિકલ એન્જિનિયરિંગ વિષયના છે. પાંચ વર્ષની આ ફેલોશિપ અંતર્ગત દરેક પ્રોફેસરને મહિને રૂ. ૮૫,૦૦૦ અને દર વર્ષે રૂ. ૭ લાખની રિસર્ચ ગ્રાન્ટ મળશે.